

સુરત શહેરમાં અડાજણ પો.સ્ટે.ના મોબાઇલ રનેચીંગના ૩ ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને કુલે
મોબાઇલ ફોન નંગ-૧૪ સાથે પકડી પાડતી અડાજણ પોલીસ.

સુરત શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલ/ચેન રનેચીંગના ગુન્હા બનતા અટકાવવા સારૂ જુદી જુદી ટીમો બનાવી અડાજણ પોલીસના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સના HC મનોજભાઈ મોતીરામ PC ચંદુભાઈ પ્રભુભાઈ તથા PC જયપાલસિંહ ગંભીરસિંહ નાઓની સંયુક્ત બાતમી આધારે આરોપી નં.(૧) સાહીદ ઉર્ફે રાખ S/O હારૂન સૈયદ ઉ.વ.૨૧ ધંધો- હાલ બેકાર રહે. ઘર નં. ૪/૪૩૪૫, સૈફી મહોલ્લો, ઝાંપાબજાર મહીઘરપુરા, સુરત શહેર (૨) અબુ આમીર ઉર્ફે લાલો S/O શબ્બીરભાઈ કાંસકીવાલા ઉ.વ.૨૬ ધંધો- વેપાર રહે. ઘર નં.૧૧/૮૦૪, મહમંદી એપાર્ટમેન્ટ સોપારીગલી જુમ્મા મસ્જીદની પાછળ સીંધીવાડ ચોકબજાર, સુરત શહેર નાઓને ચોરીના અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૬ તથા આરોપીએ ચોરીમાં ઉપયોગ કરેલ એક્ટીવા મોપેડ નં.GJ-05-NG-0136 સાથે પકડી તેઓની પુછપરછ કરી તેઓએ ચોરીના બીજા વેચાણ કરેલ મોબાઇલ આરોપી નં.(૩) મુદ્દસસીર S/O મહમંદ મુશ્તાક અહમદ મુશ્શી ઉ.વ.૨૦ ધંધો-ઓનલાઇન વેપાર રહે. ઘર નં.૧૧/૨૨૧૭, કોલીવાડ મહોલ્લો, મીર્ઝાસામી રોડ મુગલીસરા ચોકબજાર સુરત શહેર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને વેચાણથી આપેલ હોવાની હકીકત જણાવતા તેઓને પકડી પાડી આરોપી નં.(૩) મુદ્દસસીર S/O મહમંદ મુશ્તાક અહમદ મુશ્શી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પાસેથી ચોરીના વેચાણથી ખરીદ કરેલ મોબાઇલ ફોન-૫ કબજે કરી તેઓને વિશ્વાસમાં લઇ યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરે એક ચોરીનો મોબાઇલ ખરીદ કરી તે મોબાઇલ ફોનનું ગુગલમાંથી મોબાઇલ ફોનના બિલનો રકીન શોટ લઇ તે બિલનો રકીન શોટ મોબાઇલ ફોનમાં ઇસ્ક્રાગ્રામ એપ્લિકેશનમાં એડીટીંગ કરી ડુપ્લીકેટ બિલ બનાવી પ્રિન્ટ કાઢી અન્ય વ્યકિતને વેચાણથી આપેલ જે ડુપ્લીકેટ બિલ તથા સદર મોબાઇલ ફોન મળી કુલે મોબાઇલ ફોન નંગ-૧૪ કિ.રૂ.૬૩,૫૦૦/- તથા એક્ટીવા મોપેડ નં.GJ-05-NG-0136 કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલે કિ.રૂ.૯૩,૫૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી અડાજણ પોલીસ સ્ટેશનના નીચે મુજબના ગુનાઓ ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

ડિટેક્ટ થયેલ ગુનાઓ (૩)

(૧) અડાજણ પો.સ્ટે.ગુ.ર.નં.પાર્ટ-A-૧૧૨૧૦૦૦૩૨૧૧૧૫૯/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૩૭૯ (એ)(૩), ૧૧૪. (૨) અડાજણ પો.સ્ટે.ગુ.ર.નં.પાર્ટ-A-૧૧૨૧૦૦૦૩૨૧૧૧૬૦/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૩૭૯ (એ)(૩), ૧૧૪. (૩) અડાજણ પો.સ્ટે.ગુ.ર.નં.પાર્ટ-A-૧૧૨૧૦૦૦૩૨૧૧૧૬૧/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૩૭૯ (એ)(૩), ૧૧૪